

ત્વરિત જાહેરાત માટે

સિટી ઓફ બ્રેમ્પટન પ્રથમ વખત રજૂ કરે છે પર્ફોર્મિંગ આર્ટ્સ સ્ટ્રેટેજીક પ્લાન

બ્રેમ્પટન, ઓન્ટારિયો (04 મે 2022) – આજે બ્રેમ્પટન સીટી કાઉન્સિલે પર્ફોર્મિંગ આર્ટ્સના પ્રથમ સ્ટ્રેટેજીક પ્લાન 2022 થી 2027નું અનુમોદન કર્યું. બ્રેમ્પટનની ભાવના અને વિવિધતાને પ્રતિબિંબિત કરતા એક પ્રેરણાદાયી પર્ફોર્મિંગ આર્ટ્સ સમુદાય બનાવવાના આશયથી ભવિષ્ય માટેનું આ માળખું ત્યાં સુધી કેવી રીતે પહોંચી શકાશે તેનો પાયો નાંખશે અને તે સિટી ઓફ બ્રેમ્પટનની બહોળી પ્રાથમિકતાઓ અને લક્ષ્યો સાથે સરખીત છે.

સ્ટ્રેટેજીક પ્લાનથી ત્રણ માર્ગદર્શક સિદ્ધાંતો ઓળખી શકાયા છે જે વિવિધતા અને સમાવેશિતા, શહેર-વ્યાપી કેમ્પસ અને સમુદાય નિર્માણ સહિત આગળના કાર્યને માટે ટેકાડપ સ્તંભનું કામ કરે છે.

સ્ટ્રેટેજીક પ્લાન ચાર વ્યુહાત્મક પ્રાથમિકતાઓ પર કેન્દ્રિત હશે.

- **સમુદાય પ્રોગ્રામિંગ અને આઉટરીચનો વિસ્તાર કરવો** પર્ફોર્મિંગ આર્ટ્સ પ્રોગ્રામિંગ મોડેલ તે સુનિશ્ચિત કરવા માટે વિસ્તારાશે જેથી તે પ્રેક્ષકો અને સર્જકોની વ્યાપક શ્રેણી માટે આવકાર્ય અને સુસંગત હોય. કલાકારો અને સર્જકો, સમુદાયના સહયોગીઓ, નવા અને હાલના પ્રેક્ષકો અને શહેરના અન્ય વિભાગો સહિત સમગ્ર કલા ઈકોસિસ્ટમમાં સ્થાનિક સમુદાય સાથે સહાયક અને સ્થાયી સંબંધો બાંધીને આ પરિપૂર્ણ કરવામાં આવશે.
- **સમાનતા, વિવિધતા, સમાવેશીતા અને સુગમતાને ઘેરાઈ આપવી** પર્ફોર્મિંગ આર્ટ્સ ડિવિઝન એક પરિપૂર્ણ કહી શકાય એવું સમાનતાનું માળખું અને એક્શન પ્લાન તૈયાર કરશે જેમાં નીતિ, પ્રોગ્રામિંગ, પ્રેક્ષકગણનો વિકાસ, માર્કેટિંગ અને આઉટરીચ જેવા ક્ષેત્રોનો સમાવેશ થશે.
- **પર્ફોર્મિંગ આર્ટને લગતા તમામ સ્થળો પર સુવ્યવસ્થિત માર્કેટિંગ, સંચાર વ્યવસ્થા અને વેબસાઇટમાં નિવેશ** કરો. શહેરની ઉચ્ચતમ ક્ષમતા, બહુહેતુક સુવિધાઓ, સંસાધનો અને સેવાઓ સમુદાયો માટે પર્ફોર્મિંગ આર્ટના અનુભવોની વિશાળ શ્રેણી પ્રદાન કરશે. એવા એક પ્લાનને વિકસાવાશે જેથી પર્ફોર્મિંગ આર્ટ્સની સવલતો આંતરસંબંધિત, બહુ-સ્થળ કેમ્પસ તરીકે ઉભરી આવે જેથી આ ડિવિઝનનો શહેરમાં થયેલ વ્યાપક પ્રભાવ વધુ સારી રીતે જણાઈ આવે અને તમામ સ્થળોના ઉપયોગને પ્રોત્સાહિત કરવા માટે જરૂરી વધારાની સહાયતા સુલભ થઈ શકે.
- **સંસ્થાકીય સ્થિતિસ્થાપકતાનો વિકાસ** સ્ટાફ અને વિત્તીય સંસાધનો સહિત સંસ્થાની પ્રચાલનીય જરૂરિયાતોની સમીક્ષા અને નવા વિત્તીય માર્ગોનું અને સાથે ભંડોળ ભેગું કરવાના સ્ત્રોતોનું અનુકૂલન કરવું અથવા વિકસાવવા.

જેથી નાણાકીય ટકાઉપણાને સુનિશ્ચિત કરી શકાય.

પર્ફોર્મિંગ આર્ટ્સ ટીમ આગામી પાંચ વર્ષમાં સ્ટ્રેટેજિક પ્લાનના અમલીકરણ માટે વિગતવાર અને તબક્કાવાર રોડમેપનો ઉપયોગ કરશે. પર્ફોર્મિંગ આર્ટ્સના સ્ટ્રેટેજિક પ્લાનને જોવા માટે અહીં મુલાકાત લો brampton.ca/performingarts.

સુવાક્યો

“સિટી ઓફ બ્રમ્પટનના પર્ફોર્મિંગ આર્ટ્સના સ્થળો એવી જગ્યા છે જ્યાં આપણા શહેરની રંગારંગ કલાઓ જીવી ઉઠે છે, જ્યાં આપણા પ્રાયોજનના કેન્દ્ર સ્થાને સમુદાય હોય છે. બ્રમ્પટનના કલાત્મક લેન્ડસ્કેપને હવે અને ભવિષ્યમાં મજબૂત બનાવવામાં મદદ કરવા માટેના અમારા સહુ પ્રથમ પર્ફોર્મિંગ આર્ટ્સ સ્ટ્રેટેજિક પ્લાનનો વિકાસ જોવા માટે હું ઉત્સાહિત છું.”

- પેટ્રિક બ્રાઉન, મેયર, સિટી ઓફ બ્રમ્પટન

“બ્રમ્પટન કલાત્મક વૈવિધ્યની દિવાદાંડી છે, એક ગલન પ્રબુદ્ધ શહેર જ્યાં તમામ ઉંમરના, પૃષ્ઠભૂ ધરાવતા અને વ્યવસાયો ધરાવતા લોકો માટે પર્ફોર્મિંગ આર્ટ્સ અતિમહત્વપૂર્ણ છે. બ્રમ્પટન પચરંગી છે અ તે અગત્યનું છે કે આપણી વૈવિધ્યસભર, સર્જનાત્મક વસ્તી અમારા પ્રોગ્રામિંગમાં પ્રતિબિંબિત થાય. પર્ફોર્મિંગ આર્ટ્સ સ્ટ્રેટેજિક પ્લાનથી આવનાર વર્ષો સુધી બ્રમ્પટન સફળતાને વરેલી સ્થિતિમાં રહી શકે તેમ છે.”

- રોવેના સાન્તોસ, રીજનલ કાઉન્સિલર, વોર્ડ 1 અને 5; પ્રમુખ, કમ્યુનિટી સર્વિસિસ, સિટી ઓફ બ્રમ્પટનના પ્રમુખ

“બ્રમ્પટનની પર્ફોર્મિંગ આર્ટ્સ ટીમે પર્ફોર્મિંગ આર્ટ્સની એક પાકી વ્યુહાત્મક યોજના બનાવવા માટે જાહેર જનતા અને વિવિધ હિસ્સેદારો સાથે સંકળાયેલું એક અપવાદરૂપ કાર્ય કર્યું છે. તે સુનિશ્ચિત કરવા માટે કે તે બ્રમ્પટનના ભાવ અને વિવિધતાને પ્રતિબિંબિત કરે, આગામી પાંચ વર્ષોમાં, આ માળખું પર્ફોર્મિંગ આર્ટ્સના સમુદાયને પરિવર્ધિત કરશે અને પ્રેરણા આપશે.”

- પૉલ મોરિસન (Paul Morrison), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સિટી ઓફ બ્રમ્પટન

"પફોર્મિંગ આર્ટ્સ ટ્રેક વ્યક્તિનો આભારી છે જેમના પ્રતિભાવોથી અમારો પ્રથમ સ્ટ્રેટેજીક પ્લાન સાકારવામાં મદદ મળી. અમે હવે મંચ પરથી કે બહારથી કાગળ પરના રચનાત્મક શબ્દોમાંથી પ્રેરણાદાયી કામો કરવા માટે પ્રતિબદ્ધ છીએ."

- સ્ટિવન સ્કિપર (Steven Schipper), એગ્ઝિક્યુટિવ આર્ટિસ્ટિક ડાયરેક્ટર, પફોર્મિંગ આર્ટ્સ, સિટી ઓફ બ્રમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 7,00,000 લોકો વસે છે અને તેમાં 75,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. વધુ જાણવા માટે www.brampton.ca

મિડિયા સંપર્ક (MEDIA CONTACT):

સીટી ઓફ બ્રમ્પટન મલ્ટિકલ્ચરલ મિડિયા

multiculturalmedia@brampton.ca